



DCA-19080002020500 Seat No. _____

M. Com. (Sem. II) (CBCS) (W.E.F. 2019) Examination

July - 2022

Global Strategic Management

Time : **2.30** Hours]

[Total Marks : **70**

- 1** વ્યૂહાત્મક મેળ, વ્યૂહાત્મક ઈરાદો, વ્યૂહાત્મક ઉચ્ચલક્તા અને ખેચ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. **20**

અથવા

- 1** વૈશિક વ્યૂહાત્મક સંચાલનની પ્રક્રિયાને વિગતવાર સમજાવો. **20**

- 2** નોંધ લખો : (કોઈપણ બે)
- 20**

- (1) PEST વિશ્લેષણ
- (2) ભૂલ્ય સાંકળ વિશ્લેષણ
- (3) મિશેલ પોર્ટરના પાંચ બળોનું મોડેલ
- (4) સાધન આધારિત જ્યાલ

- 3** વૃદ્ધિ અને સ્થિરતા વ્યૂહરચનાઓ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો. **15**

અથવા

- 3** મારૂતિ સુનુકી લિમિટેડની મદદથી GE મેટ્રિક્સ અને BCG મેટ્રિક્સની ચર્ચા કરો. **14**

- 4** વ્યૂહાત્મક ભૂલ્યાંકન અને નિયંત્રણ માટેની વિવિધ તરકીબો સંક્ષિપ્તમાં સમજાવો. **15**

અથવા

- 4** વ્યૂહરચના અમલીકરણ એટલે શું? વ્યૂહરચના અમલીકરણમાં સામેલ વિવિધ મુદ્દાઓની ચર્ચા કરો. **15**

ENGLISH VERSION

- 1 Explain strategic fit, strategic leverage and stretch with suitable example. 20**

OR

- Explain global strategic management process in detail. 20**

- 2 Write note on : (any two) 20**

- (1) PEST analysis.
- (2) Value chain analysis
- (3) Michael Porter's Five Force Model
- (4) Resource Based View

- 3 Explain growth and stability strategies with suitable examples. 15**

OR

- Discuss GE matrix and BCG matrix with the help of Maruti Suzuki Ltd. 15**

- 4 Explain various techniques for strategic evaluation and control. 15**

OR

What is strategic implementation ? Explain various issues involved in strategy implementation.
